



# GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

(Established by Government of Gujarat under Gujarat Act No. : 20 of 2007)

## ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી

(ગુજરાત સરકારના ગુજરાત અધિનિયમ ક્રમાંક : ૨૦/૨૦૦૭ દ્વારા સ્થાપિત)

જા.ક.નં.: જી.ટી.યુ./કલ્ચરલ/૨૦૨૨-૨૩/૧૫૬

તારીખ:- ૦૭/૦૨/૨૦૨૩

### પરિપત્ર

વિષય:- ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ૧. વ્યક્તિત્વ વિકાસ તાલીમ શીબીર, ૨. નાટ્ય તાલીમ શીબીર અને ૩. નૃત્ય તાલીમ શીબીરમાં આપની કોલેજના પ્રતિનિધિને ભાગ લેવા બાબત

ઉક્ત વિષય અંગે જણાવવાનું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા G20-Summit "University Connect : Engaging Young Minds" ના ઉપક્રમે આગામી માર્ચ માસમાં અનુક્રમે (૧):- વ્યક્તિત્વ વિકાસ તાલીમ શીબીર (૨):- નાટ્ય તાલીમ શીબીર અને (૩):- લોકનૃત્ય તાલીમ શીબીરનું આયોજન કરવાનું વિચારવામાં આવ્યું છે. આ તાલીમ શિબિરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજના વિદ્યાર્થી પ્રતિનિધિઓ ભાગ લઈ શકશે. આ તાલીમ શિબિરમાં જોડાવા માટે આપની કોલેજના એક અને એક વિદ્યાર્થીનીને પસંદ કરીને તેમના નામ સહિતની વિગતો અત્રે મોકલવાની રહેશે. તાલીમ શિબિરના નિયમો, આ સાથે પરિશિષ્ટ - ૧ થી સામેલ છે તે વંચાણે લેવા અને તેમાં દર્શાવેલ નિયમો અનુસાર આપની કોલેજના બે પ્રતિનિધિને સદરહુ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે મોકલવા આથી અનુરોધ કરવામાં આવે છે.

આ તાલીમ શિબિરમાં આપ જે બે પ્રતિનિધિ પસંદ કરો તેની વિગતો આ સાથે પરિશિષ્ટ - ૨ થી સામેલ નિયત પ્રવેશપત્રમાં ભરીને, તેમાં આચાર્યશ્રીના સહી-સિક્કા કરી, આપના જવાબીપત્ર સાથે જોડીને અત્રે તારીખ ૨૮/૦૨/૨૦૨૩ સુધીમાં પત્ર દ્વારા તેમજ ઈ-મેઈલ એડ્રેસ - [sports@gtu.edu.in](mailto:sports@gtu.edu.in) પર મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.

આ તાલીમ શિબિર અંગે કોઈ મૂંઝવણ હોય કે માર્ગદર્શનની જરૂર હોય તો ફોન નંબર: ૦૭૯-૨૩૨૬૭૬૩૨ તેમજ [sports@gtu.edu.in](mailto:sports@gtu.edu.in) પર સંપર્ક કરી શકશો.

ઉક્ત બાબતે સત્વરે કાર્યવાહી કરી અત્રે બે વિદ્યાર્થી પ્રતિનિધિના નામ મોકલી આપશો જેથી કરીને સૂચિત શિબિરનું આયોજન કરવામાં સરળતા રહે.

બીડાણ: ઉપર મુજબ

  
કુલસચિવ ૬/૨/૨૩

પ્રતિ,

(૧) આચાર્યશ્રી / ડાયરેક્ટરશ્રી જી.ટી.યુ. સંલગ્ન તમામ સંસ્થાઓ

(૨) પી.એ / પી.એસ. ટુ માનનીય કુલપતિશ્રી

(૩) પી.એ ટુ માનનીય કુલસચિવ

Winners of: "Most Promising University of India 2020" ❖ "1" rank Among All Universities in Gujarat 2020 by Uni Rank"  
❖ "1" Rank in Gujarat State Institutional Ratings Framework (GSIRF) 2019" ❖ "National Leadership Excellence Award 2019 in Technical Education" ❖ "India's Most Trusted State University 2019" ❖ "Outstanding University in West India 2019"

Head office : GTU Campus, Nr. Visat Three Road , Visat-Gandhinagar Road , Chandkheda, Ahmedabad - 382 424. Gujarat, India.

Phone :- +91 079-23267521/570

e-mail : [info@gtu.ac.in](mailto:info@gtu.ac.in)

Website : [www.gtu.ac.in](http://www.gtu.ac.in)

## પરિશિષ્ટ - ૧

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા (૧):- વ્યક્તિત્વ વિકાસ તાલીમ શીબીર

(૨):- નાટ્ય તાલીમ શીબીર અને (૩):- લોકનૃત્ય તાલીમ શીબીરનું

### નિયમો:

- (૧):- આ તાલીમ શિબિર ગુજરાતના કોઈ સૌંદર્યમય અને પ્રાકૃતિક સ્થળે યોજાશે.
- (૨):- નાટ્ય અને નૃત્યની તાલીમ શિબિર ૦૭ દિવસ માટે અને વ્યક્તિત્વ વિકાસ શિબિર ૦૪ દિવસ માટે યોજાશે.
- (૩):- આ તાલીમ શિબિર સંભવતઃ માર્ચ-એપ્રિલ ૨૦૨૩ ના ગાળા દરમિયાન અનુકુળતા અનુસાર ઉક્ત દર્શાવેલ દિવસો માટે યોજાશે.
- (૪):- આ શિબિરમાં તમામ દિવસ હાજર રહી તાલીમ લેવી ફરજિયાત રહેશે.
- (૫):- દરેક કોલેજ પોતાના પ્રતિનિધિ તરીકે માત્ર બે જ વિદ્યાર્થીને મોકલી શકશે. જેમાં એક વિદ્યાર્થી ભાઈ એક વિદ્યાર્થી બહેન રહેશે. સંસ્થામાં જો માત્ર બહેનો જ અભ્યાસ કરતી હોય તો એક બહેનનું નામ અને માત્ર ભાઈઓ અભ્યાસ કરતા હોય તો માત્ર એક ભાઈનું નામ જ મોકલવાનું રહેશે.
- (૬):- શિબિરમાં ભાગ લેવા આવનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને તેમની કોલેજના સ્થળથી શિબિરના સ્થળ સુધી આવવા-જવાનું એસ.ટી. બસનું ભાડું કે રેલ્વે સ્લીપર કોચના ભાડાની મર્યાદામાં આવતું પ્રવાસ ભાડું ચુકવવામાં આવશે.
- (૭):- તાલીમાર્થીઓને તમામ દિવસની તાલીમ, ભોજન તથા નિવાસની વ્યવસ્થા યુનિવર્સિટી તરફથી આપવામાં આવશે.
- (૮):- આ તાલીમ શિબિરનો સમય સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૧:૦૦ તથા સાંજના ૦૪:૦૦ થી ૦૮:૦૦ દરમિયાનનો રહેશે.
- (૯):- આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર તાલીમાર્થીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે.
- (૧૦):- આ શિબિરના આયોજનની તમામ જાણકારી સંસ્થાને કરવામાં આવશે. પસંદ થયેલા શીબીરાર્થીને જાણ કરવાની જવાબદારી સંસ્થાની રહેશે.
- (૧૧):- આ તાલીમ શિબિર વ્યક્તિત્વ અને સાંસ્કૃતિક વિકાસનો મહિમા કરતી શિબિર છે. તેથી આ પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવતા ભાઈ-બહેનોની પસંદગી કરવા ખાસ અનુરોધ છે.
- (૧૨):- એક વિદ્યાર્થી એક જ શિબિરમાં ભાગ લઈ શકશે. તેથી એક વિદ્યાર્થી એક જ શિબિરની પસંદગી કરી શકશે.
- (૧૩):- આ પરિપત્ર માત્ર માનાંકન મંગાવવા માટે છે. શિબિરના આયોજનની વિગતો પસંદગી પામેલાને અલગથી મોકલવામાં આવશે.
- (૧૪):- આ શિબિરનું પ્રવેશપત્ર પરિપત્રમાં દર્શાવેલ તારીખ સુધીમાં યુનિવર્સિટીને મળી જવું અનિવાર્ય ગણાશે. સમય મર્યાદા બાદ આવેલ પ્રવેશપત્ર સ્વીકારાશે નહિ.
- (૧૫):- પસંદગી પામેલા શીબીરાર્થીએ તાલીમમાં જોડાવા આવતી વખતે શારીરિક સજ્જતાનું પ્રમાણપત્ર, કોવીડ-૧૯ ની બે વેક્સીન લીધાનું પ્રમાણપત્ર તથા કોલેજનું આઈ-કાર્ડ પોતાની સાથે રાખવાનું રહેશે.
- (૧૬):- ઉક્ત તમામ નિયમોનું પાલન સંસ્થાએ અને શીબીરાર્થીએ ચુસ્ત રીતે કરવાનું રહેશે.

## પરિશિષ્ટ - ૨

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યોજનાર વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર, નાટ્ય તાલીમ શિબિર અને લોકનૃત્ય શિબિરમાં ભાગ લેવા આવનાર વિદ્યાર્થી પ્રતિનિધિની વિગતો:

(૧):- સંસ્થાનું નામ અને સરનામું: \_\_\_\_\_

(૨):- તાલીમાર્થીનું નામ અને સરનામું: \_\_\_\_\_

(૩):- તાલીમાર્થીને સહભાગી થનાર શિબિરનું નામ: \_\_\_\_\_

(૪):- તાલીમાર્થીએ વ્યક્તિત્વ વિકાસ, નાટ્ય કે નૃત્ય ની કોઈ તાલીમ લીધી હોય તો તેની વિગત: \_\_\_\_\_

(૫):- તાલીમાર્થીએ એન.એસ.એસ.ની કોઈ તાલીમ લીધી હોય તો તેની વિગત: \_\_\_\_\_

(૬):- તાલીમાર્થીએ કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય કે તાલીમ લીધી હોય તો તેની વિગત: \_\_\_\_\_

(૭):- વિદ્યાર્થીએ કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી હોયતો તેની વિગત: \_\_\_\_\_

(૮):- તાલીમાર્થીનો મોબાઈલ નંબર: \_\_\_\_\_

(૯):- તાલીમાર્થીનું ઈ-મેઈલ એડ્રેસ: \_\_\_\_\_

(૧૦):-તાલીમાર્થીના અભ્યાસનું વર્ષ: \_\_\_\_\_

(૧૧):- તાલીમાર્થીના અભ્યાસનો વિષય: \_\_\_\_\_

આચાર્યની સહી: \_\_\_\_\_

આચાર્યનું નામ: \_\_\_\_\_

આચાર્યનો સિક્કો: \_\_\_\_\_

નોંધ:- ઉપરોક્ત માહિતી ફરજિયાત પણે ભરવાની રહેશે.